



ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર.

માર્ચ - ૨૦૨૦ ની SSCE/HSCE ની જાહેર પરીક્ષા સંબંધિત પરીક્ષાર્થીઓ માટેની અગત્યની સૂચનાઓ

1. તમામ પરીક્ષાર્થીઓએ આવેદનપત્ર ભરેલ શાળા પાસેથી **Online Download** કરેલ આચાર્યના સહી-સિક્કાવાળું પ્રવેશપત્ર (હોલ ટીકીટ) મેળવી લેવું. પ્રવેશપત્ર (હોલ ટીકીટ) સાથેનું સૂચનાપત્ર પણ અવશ્ય મેળવી લેવું.
2. પરીક્ષાર્થીએ પ્રવેશપત્ર (હોલ ટીકીટ) પરીક્ષા સમયે પોતાની પાસે રાખવું. પરીક્ષા સમયે તે બતાવવું. પ્રવેશપત્ર (હોલ ટીકીટ) વિના પરીક્ષા ખંડમાં હાજરી આપી શકાશે નહીં. પરીક્ષાર્થી કોઈ માહિતી છુપાવી ખોટી માહિતીના આધારે પરીક્ષામાં પરીક્ષાર્થી ઉપસ્થિત થયાનું ધ્યાને આવશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
3. કોઈ સંજોગોમાં શાળા દ્વારા પ્રવેશપત્ર (હોલ ટીકીટ) પ્રિન્ટ ન મળેતો પણ એપ્લીકેશન નંબર / SID નંબર અને જન્મ તારીખ/ શાળાના ઇન્ડેક્સ નંબરનો ઉપયોગ કરી ડાઉનલોડ કરી શાળાના આચાર્યશ્રીના સહી/સિક્કા કરાવવાના રહેશે પ્રવેશપત્ર (હોલ ટીકીટ) સાથેનું સૂચનાપત્ર પણ અવશ્ય મેળવી લેવું.
4. શાળાએ પરીક્ષાર્થીની યાદીમાં પરીક્ષાર્થીને પ્રવેશપત્ર (હોલ ટીકીટ) તથા સૂચનાપત્ર આપ્યા બદલ પરીક્ષાર્થીની સહી લેવાની અવશ્ય રહેશે.
5. પરીક્ષાર્થીને પ્રવેશપત્ર મળે કે તરત જ તેમાં દર્શાવેલી નીચેની બાબતો ચકાસી લેવી.
(અ) પરીક્ષાર્થીનું પૂરેપૂરું નામ (અંગ્રેજી સ્પેલિંગ/જોડણી ચકાસી લેવા.) (બ) કેન્દ્ર તથા તારીખવાર, વિષયવાર પરીક્ષા અંગેની બિલ્ડિંગ વ્યવસ્થા જાણી લેવી/ચકાસવી. (ક) વિષયો, ઉત્તરની ભાષા, મુક્તિ વગેરે. (ડ) પરીક્ષા સ્થળનું નામ, સરનામું તેમજ બ્લોક નંબર (ઇ) જન્મ તારીખ ચકાસણી કરવી. ચકાસણી કરતાં જો કોઈ ભૂલ જણાય તો પ્રવેશપત્ર (હોલ ટીકીટ) મેળવી તરતજ તેની લેખિત જાણ શાળાના આચાર્ય મારફતે સંબંધિત પરીક્ષા વિભાગ, ગાંધીનગરને કરવી
6. દરેક વિદ્યાર્થીએ પોતાના રહેઠાણના સ્થળેથી પરીક્ષા સ્થળ સુધી પહોંચવાનો સમય વાહનવ્યવહારના સુવિધા અને ટ્રાફિકને ધ્યાને લઈને પરીક્ષા સ્થળ ઉપર પહોંચવા માટેનો સમય નિયત કરવો જેથી મોડા પડી શકાય નહીં.
7. ધો-12 સામાન્ય પ્રવાહના નીચે દર્શાવેલ વિષય અને વિષય કોડની પરીક્ષાનો સમય સવારના સેશન નો રહેશે (પરીક્ષાનું ટાઇમટેબલ જોઈ લેવું) વિષય અને વિષય કોડ - સહકાર પંચાયત (111), ઇતિહાસ (029), કૃષિ વિદ્યા (060), ગૃહજીવન વિદ્યા (068), વસ્ત્ર વિદ્યા (076), પશુપાલન અને ડેરીવિજ્ઞાન (080), વનવિદ્યા અને વનઔષધી વિદ્યા (351), સેક્રેટરિયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્રવ્યવહાર (337), સામાજિક વિજ્ઞાન (058), સંગીત સૈદ્ધાંતિક (146), ચિત્રકામ સૈદ્ધાંતિક (137), ચિત્રકામ પ્રાયોગિક (138), રાજ્યશાસ્ત્ર (023).
8. જે પરીક્ષાર્થી કોઈપણ પ્રકારનું ગેરવર્તન કરશે તેમજ સ્થળ-સંચાલક અથવા નિરીક્ષકે આપેલી સૂચનાનું ઉલ્લંઘન કરશે તેની સામે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમ - 2005 (સુધારેલ)ની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ નિયમાનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
9. પરીક્ષાર્થી દ્વારા સામે નીચે દર્શાવેલ છે તે પૈકી કોઈપણ ગેરવ્યાજબી વર્તણૂક થયાનું ધ્યાને આવશે તો બોર્ડના પરીક્ષા વિનિયમો અનુસાર તેવો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
(અ) તેઓ પુસ્તકો, નોંધ અથવા કોઈ છાપેલા યા લખેલા કાગળો સાથે લાવશે કે તેમાંથી ઉતારો કરવાનો પ્રયત્ન કરશે અથવા પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક ઉપકરણો (દા.ત. મોબાઇલફોન, સ્માર્ટવોચ(ડિજિટલ વોચ), બ્લ્યુટૂથ, સાઇન્ટીફિક કેલ્ક્યુલેટર કે અન્ય) સાથે રાખશે.
(બ) પોતાની બેઠક અનઅધિકૃત રીતે છોડશે, અન્ય પરીક્ષાર્થી સાથે વાતચીત કરશે કે ઉત્તરવહી દર્શાવવાનો/બતાવવાનો પ્રયાસ કરશે કે ખોટી જગ્યાએ બેસી પરીક્ષા આપશે.
(ક) પ્રશ્નપત્ર, ઉત્તરવહી કે પુરવણી બહાર લઇ જશે અથવા બહાર લઇ જવાનો પ્રયત્ન કરશે.
(ડ) કોઈ પણ પ્રકારનું ગેરવર્તન કરશે કે પરીક્ષાખંડમાં ધુમ્રપાન કરશે.
(ઇ) ઉત્તરવહી, પુરવણી પર પોતાની ઓળખ માટે નિશાની કરે અથવા તો દેવી-દેવતાઓની નિશાની કે નામ લખે, ધર્મને લગતી નિશાની કરે, અન્ય કોઈ પણ વિશિષ્ટ નિશાની કરે તો એ બધી બાબતો ગેરરીતિમાં ગણાશે.
(ફ) પરીક્ષા પરિસરમાં મોબાઇલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે રાખવાના કિસ્સાને ગેરરીતિ ગણવામાં આવશે તથા પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવશે.
10. પરીક્ષામાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ થતી જણાય તો કોઈ પણ નાગરિક સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને જાણ કરી શકશે. રાજ્યકક્ષાએ આ બાબતની જાણ ગાંધીનગર ખાતેના કંટ્રોલ રૂમના ફોન નંબર 9909038768, 9909038769, 079-23253819 પર કરવાની રહેશે, જેથી સત્વરે નિયંત્રક પગલાં લઇ શકાય.
11. પરીક્ષાલક્ષી માગદર્શન માટે બોર્ડની હેલ્પ લાઇન નંબર-1800- 233- 5500 પર ફોન કરી શકાશે તથા માનસિક તાણ અનુભવતા વિદ્યાર્થી વાલીઓ જીવન આસ્થા હેલ્પ લાઇન નંબર 8602662345 તથા 0261 - 6554050 પરથી માર્ગદર્શન મેળવી શકાશે.

ડી.એસ.પટેલ

સચિવ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર
માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર